



જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૩૦/૧૨/૨૦૧૮ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૫૨૮/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૦૨ કેસ કરી, ૯૭ વ્યક્તિઓને ઝડપી, ૨૮૭ લીટર દેશી દારૂ, ૪૦ બોટલ ઈંગ્લીશ દારૂ, ૦૧ ક્વોર્ટર ઈંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૦૧ કેસ કરી ૦૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૨૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૫૨૯/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૨૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૨૫૩૦/૧૮

દરીયાપુર : હસુમતીબહેન નવિંનચંદ્ર પટેલ (રહે. શ્રીજી નિવાસ મોટા વાઘજીપુરા દરિયાપુર) એ તા.૨૯/૧૨/૧૮ નારોજ દરીયાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૧૨/૧૮ કલાક ૧૨/૩૦ વાગ્યાના સુમારે બે અજાણ્યા ઇસમો (૨૫ થી ૩૫ વર્ષના આશરાના) ભેગામળી હસુમતીબહેનના ઘરે આવી, સોના-ચાંદી ના વાસણો અને દાગીના ચમકાવીએ છીયે” તેમ કહી, હસુમતીબહેન ના હાથ માં પહેરેલ સોનાની બંગડી નંગ-૨ કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- મતાની એક લીકવીડ ભરેલ ડબ્બામાં નાંખી, હસુમતીબહેન તથા તેમના પતિ ની નજર ચુકવી બંગડીઓ ડબ્બામાંથી કાઢી લઇ નાસી જઇ હસુમતીબહેન સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુના ની તપાસ પો.સ.ઇ.શ્રી બી.જે.જોશી ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૨૫૩૧/૧૮

મેઘાણીનગર : મીનાબહેન મહેશસિંહ ભદોરીયા (ઉ.વ.૪૦)(રહે.શ્યામનગર ગલી નંબર-૫ ભગવતી સ્કુલ પાસે ભાર્ગવ રોડ મેઘાણીનગર) એ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૧૨/૧૮ બપોરના ૨/૪૫ વાગ્યાના સુમારે આરોપી રવિ શર્મા (૨૦ થી ૨૫ ના આશરાનો જેના પુરા નામ સરનામાની ખબર નથી તે) મીનાબહેનના ઘરમાં પ્રવેશ કરી, તિજોરીમાંથી રોકડ રૂપિયા ૩૦,૦૦૦/- અને મંગળસુત્ર કિંમત રૂપિયા ૫,૦૦૦/- ચોરી કરી લઇ ગયો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.ડી.મકવાણા ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૨૫૩૨/૧૮

પાલડી : નરેન્દ્રસિંહ તખતસિંહ રાઠોડ (ઉ.વ.૫૦)(રહે,શ્રી નિવાસ બિલ્ડિંગ હોટલ જાસ્મીન ની બાજુમાં ફતેપુરા પોલીસ ચોકીની બાજુમાં પાલડી) એ તા.૨૯/૧૨/૧૮ પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૧૨/૨૦૧૮ રાતના ૯/૦૦ થી તા.૧૯/૧૨/૨૦૧૮ ના કલાક ૭/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના ઘર નજીક પાર્ક કરેલ પોતાની એસ્ટીમ કાર નંબર જીજે.૧૮.એ.બી.૩૪૫૭ કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦/-મતાની પાર્ક કરી મુકી હતી. જેની કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એ.અસારી ચલાવે છે.

પતંગની દોરી ગળામાં આવી જતાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૨૫૩૩/૧૮

ખોખરા : મેહુલસિંહ દિનેશભાઈ ડાભી (ઉ.વ.૨૨)(રહે.આયોજનનગર વિંઝોલ ગામ પાસે વટવા જી.આઇ.ડી.સી) તા.૨૮/૧૨/૧૮ સાંજના ૫/૦૦ વાગ્યાના સુમારે એક્ટીવા ચલાવી હાટકેશ્વર બ્રીજ ઉપર થી સી.ટી.એમ. તરફ જતા હતા દરમ્યાન હાટકેશ્વર બ્રીજ ઉપર તેમના ગળામાં પતંગની દોરી આવી જતાં, ગળાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યા સારવાર દરમ્યાન તા.૨૮/૧૨/૧૮ સાંજના ૬/૫૫ વાગે ડો.શ્રી એ મેહુલસિંહને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ખોખરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.બી.પરમાર ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.